



Bhakta Kavi Narsinh Mehta University

Govt. Polytechnic Campus, Bhakta Kavi Narsinh Mehta University Road, Khadiya,

Junagadh, Gujarat (India)-362 263

Ph.(0)0285-2681400 / Fax : 0285-2681503

Website : <http://www.bknu.edu.in>

Email : cebknmu@gmail.com

પરીપત્ર

વિષય : યુ.જી./એલએલ.બી. સેમ.-૫ ની પ્રેક્ટીકલ/પ્રોજેક્ટ/વાઇવાની પરીક્ષાનું આયોજન કોલેજ કક્ષાએથી કરવા બાબત.
સંદર્ભ : એકેડેમિક કાઉન્સિલની તા.૨૩/૦૯/૨૦૨૧ ની બેઠક નંબર ૧૦ ના ઠરાવ ક્રમાંક ૧૦.૫૭ ના મુદ્દા નંબર ૨.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, માન્ય સંસ્થાઓના વડાઓને જણાવવાનું કે, પ્રત્યેક વર્ષે યુ.જી./એલએલ.બી. સેમ.-૫ (રેગ્યુલર તેમજ પૂરક) ની પ્રેક્ટીકલ/પ્રોજેક્ટ/વાઇવાની પરીક્ષાનું ઓફલાઇન આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતું હતું જેમાં યુનિવર્સિટી દ્વારા નિમાયેલ પરીક્ષક કોલેજ કક્ષાએ રૂબરૂ જઇને વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ/પ્રોજેક્ટ/વાઇવાની પરીક્ષા લીધા બાદ તેની માર્કશીટ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં જમાં કરવામાં આવતી હતી.

વધુમાં જણાવવાનું કે, ઉપરોક્ત સંદર્ભ તેમજ માનનીય કુલપતિશ્રીની આજ્ઞાનુસાર માત્ર ચાલુ શૈક્ષણિક વર્ષ માટે આગામી સમયમાં યોજનાર યુ.જી./એલએલ.બી. સેમ. ૫ ની પ્રેક્ટીકલ/પ્રોજેક્ટ/વાઇવાની પરીક્ષા કોલેજ કક્ષાએથી જે-તે વિષયના યુનિ. માન્યતા પ્રાપ્ત અધ્યાપક દ્વારા લેવાની રહેશે. જો કોલેજ પાસે જે-તે વિષયના યુનિ. માન્યતા પ્રાપ્ત અધ્યાપક ન હોય, તેવા કિસ્સામાં અન્ય નજીકની કોલેજના જે-તે વિષયના યુનિ. માન્યતા પ્રાપ્ત અધ્યાપક દ્વારા પ્રેક્ટીકલ/પ્રોજેક્ટ/વાઇવાની પરીક્ષાનું આયોજન તા.૦૪/૧૦/૨૦૨૧ થી તા.૩૦/૧૦/૨૦૨૧ દરમિયાન ઓફલાઇન માધ્યમ દ્વારા કરવાનું રહેશે. કોલેજ વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ/પ્રોજેક્ટ/વાઇવાની તારીખ અંગેની જાણ કરવાની રહેશે.

વિદ્યાર્થીના માર્કસ મુકવા માટેની માર્કશીટ તેમજ હાજર/ગેરહાજર રીપોર્ટ આ સાથે સામેલ બીડાણ મુજબ તમામ કોલેજ ટાઇપ કરેલ ફોર્મેટમાં તૈયાર કરવાનો રહેશે. ઉપરોક્ત માર્કશીટ તૈયાર કરતી વખતે ૩ પદ્ધતિમાંથી કોઇ પણ એક પદ્ધતિને અનુસરવાની રહેશે. (૧) વિદ્યાર્થીની યાદી SPUID ના ચડતા ક્રમમાં ગોઠવીને. (૨) વિદ્યાર્થીની અટક(Surname) ના આધારે આલ્ફાબેટના ચડતા ક્રમમાં ગોઠવીને અથવા (૩) વિદ્યાર્થીના નામ (First Name) ના આધારે આલ્ફાબેટના ચડતા ક્રમમાં ગોઠવીને તૈયાર કરવાની રહેશે. હાજર/ગેરહાજર રીપોર્ટમાં ફરજિયાત પણે હાજર રહેલ વિદ્યાર્થીઓની સહી કરાવવાની રહેશે તેમજ ગેરહાજર રહેલ વિદ્યાર્થીની સામે Absent દર્શાવવાનું રહેશે. પ્રેક્ટીકલ પરીક્ષાની માર્કશીટ અને હાજર/ગેરહાજર રીપોર્ટ તા.૧૫/૧૧/૨૦૨૧ સુધીમાં યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં જમા કરાવવાની રહેશે. યુનિ. માં માર્કશીટ જમા કરાવેલ છે તેના આધાર પુરાવા માટે તેની પહોંચ(રીસીપ્ટ) પરીક્ષા વિભાગમાંથી મેળવી કોલેજ પોતાના રેકોર્ડમાં રાખવી.

ખાસનોંધ:- ઉપરોક્ત કામગીરી માટે નોવેલ કોરોના વાઇરસ કોવીડ-૧૯ અંગે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારશ્રીઓ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકાનું યુસ્તપણે પાલન કરવાનું રહેશે. કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી (ફેસ કવર) તેમજ સામાજિક અંતર જાળવી ઉપરોક્ત કામગીરી કરવાની રહેશે.

Dr. B. K. Hardley
પરીક્ષા નિયામક

બીડાણ : માર્કશીટ તેમજ હાજર/ગેરહાજર રીપોર્ટ

નં :- બીકેએનએમયુ/પરીક્ષા/૧૭૬૦/૨૦૨૧

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,

ખડિયા, જુનાગઢ-૩૬૨૨૬૩

તા. ૨૯/૦૯/૨૦૨૧

પ્રતિ,

અત્રેની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ માન્ય સંસ્થાઓના વડાઓ તરફ...

નકલ સવિનય રવાના:-

(૧) માન.કુલપતિશ્રી/કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી

(૨) આઇ.ટી. સેલ (વેબસાઇટ પર પ્રસિધ્ધ થવા અર્થે.)

ANNEXURE-1						
BHAKTA KAVI NARSINH MEHTA UNIVERSITY-JUNAGADH						
MARK SHEET OF PRACTICAL EXAMINATIONS						
COLLEGE NAME:						
EXAM NAME:				DATE:		
COURSE NAME:				SUBJECT NAME:		
EXAMINER NAME				SIGN		MOBILE NO.:
(1).....			
(2).....			
SR NO.	SURNAME	STUDENT NAME		STUDENT SPUID NO.	TOTAL MARK	OBTAIN MARK
		FIRST NAME	LAST NAME			

➤ જો વિદ્યાર્થી ગેરહાજર રહેલ હોય તો OBTAIN MARK માં ABSENT દર્શાવવાનું રહેશે.

ANNEXURE-2					
BHAKTA KAVI NARSINH MEHTA UNIVERSITY-JUNAGADH					
REPORT OF ATTENDANCE AT THE PRACTICAL EXAMINATION					
COLLEGE NAME:					
EXAM NAME:				DATE:	
COURSE NAME:				SUBJECT NAME:	
SR NO.	SURNAME	STUDENT NAME		STUDENT SPUID NO.	SIGNATURE OF STUDENT
		FIRST NAME	LAST NAME		

➤ જો વિદ્યાર્થી ગેરહાજર રહેલ હોય તો SIGNATURE OF STUDENT માં ABSENT દર્શાવવાનું રહેશે.